

બી. ટી. કપાસના ઉત્પાદનમાં પોટાશ અને જીક સલ્ફેટ ખાતરની ઉપયોગીતા	
ડૉ. કે. બી. પોલરા	કૃષિ રસાયણશાસ્ત્ર અને જમીન વિજ્ઞાન વિભાગ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ – ૩૬૨૦૦૧
શ્રી આર. એલ. ડાવરીયા	
ડૉ. એચ. એલ. સાકરવાડીયા	
ડૉ. એન. બી. બાબરીયા	
શ્રી આર. કે. પટેલ	
કૃષિ જીવન જુન–૨૦૧૨ અંક ૧૧ પાના નં. ૧૭–૧૮	

બી.ટી. કપાસ એ એક અગત્યનો રોકડીયો પાક છે. ચાલુ સાલે ભારતમાં ૧૨૧.૬ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાયેલ. જેમાંથી કપાસનું ઉત્પાદન ૭૪૫ લાખ ગાંસડીનો અંદાજ છે. (કપાસ એડવાઈઝરી બોર્ડ – ૨૦૧૨). ગુજરાતમાં કપાસના વાવેતર વિસ્તારની દ્રષ્ટીએ મહારાષ્ટ્ર પછી બીજો નંબર આવે છે. પરંતુ કુલ ઉત્પાદનની દ્રષ્ટીએ ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. હાલ ચાલુ સાલે ગુજરાતમાં કપાસનો વાવેતર વિસ્તાર ૩૦.૨ લાખ હેક્ટર અને ઉત્પાદન ૧૧૪ લાખ ગાંસડીનો અંદાજ છે. (કપાસ એડવાઈઝરી બોર્ડ – ૨૦૧૨). હાલ પ્રતિ હેક્ટરે ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાત (૬૪૫ કિલો ગ્રામ) પ્રથમ સ્થાન ધરાવે છે.

હાલ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં બી.ટી. કપાસનો વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનમાં છેલ્લા પાંચ વર્ષથી ઉત્તરોત્તર વધારો થયેલ છે. ચાલુ સાલે સૌરાષ્ટ્રમાં બી.ટી. કપાસનો વાવેતર વિસ્તાર ૧૭.૪ લાખ હેક્ટર, ઉત્પાદન ૮૩.૨ લાખ ગાંસડી થાય તેવો અંદાજ છે. (કપાસ એડવાઈઝરી બોર્ડ – ૨૦૧૨).

ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની મોટાભાગની જમીનોમાં સેન્ટ્રિય કાર્બનની એટલે કે નાઈટ્રોજન તત્વની ઉણાપ (૭૦ ટકા) અને ફોસ્ફરસ મધ્યમ (૫૫ ટકા) જોવા મળેલ છે. આ વિભાગ દવારા સૌરાષ્ટ્રની જમીનના સર્વે દ્વારા જાણવા મળેલ છે કે સૌરાષ્ટ્રની જમીનોમાં અંદાજે ૨૭ ટકા વિસ્તારમાં પોટાશ તત્વની ખામી જોવા મળેલ છે. સાથે સાથે લોહ અને જસતની ખામીવાળો વિસ્તાર અનુક્રમે ૩૦ અને ૫૦ ટકા માલુમ પડેલ છે. આ અગત્યના રોકડીયા પાકના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર અસરકરતા પરિબળો પૈકી પોષક તત્વોની માવજત ખૂબજ અગત્યનું પરિબળ છે. કોઈ પણ પાકની ઉત્પાદકતાનો સીધો સંબંધ તેમના પોષણ પર છે. જેથી પાકની ઉત્પાદકતા વધે તેમ પોષણ પણ સમતોલમાં વધતું હોય છે. વળી કોઈપણ પાકના ઉત્પાદનમાં ખાતરનો ફણો ૪૧ ટકા જેટલો છે. આમ કોઈપણ પાકના ઉત્પાદનમાં ખાતરનું મહત્વ ખૂબ જ છે.

બી.ટી.કપાસના પાકમાં ભલામણ મુજબ નાઈટ્રોજન ખાતર ઉપરાંત પોટાશ અને જીકસલ્ફેટ ખાતર કેટલું આપવું કે જેથી સૌરાષ્ટ્રમા ચોમાસુ બી.ટી. કપાસનું વાવેતર કરતા ખેડૂતોને મહત્તમ અને અર્થક્ષમ ઉત્પાદન મળી રહે તે માટે કોઠા નં. ૧ માં દર્શાવેલ માવજત પ્રમાણે લાંબાગાળાનો ક્ષેત્રપ્રયોગ (ત્રણ વર્ષ) હાથ ધરેલ હતો જેના પરિણામોની સમીક્ષા અહીં કરવામાં આવેલ છે.

#### પોટાશ અને જસતની ખાતરની કપાસના ઉત્પાદન પર સીધી અસર:

બી.ટી. કપાસના પાકને પોટાશ ખાતરની જુદી જુદી માવજતો (૧૨૦, ૧૫૦ અને ૧૮૦ કિ.ગ્રા./હેક્ટર) પાયાના ખાતર તરીકે તેમજ બે હપામાં (અધો પોટાશ પાયાના ખાતર તરીકે તેમજ અધો પોટાશ પાક વાત્યા બાદ ૩૦ દિવસે) આપેલ. આમ પોટાશ તત્વની જુદી જુદી માવજતો પૈકી પોટાશ ૧૫૦ કિ.ગ્રામ/હેક્ટર બે હપે આપવાથી કપાસનું ઉત્પાદન (૨૭૧૩ કિ.ગ્રા./હે.) તેમજ એક હપે પાયાના ખાતર તરીકે આપવાથી ઉત્પાદન (૨૨૮૮ કિ.ગ્રા./હેક્ટર) મળેલ (કોઠા-૧). ત્યાર બાદ અનુક્રમે પોટાશ ૧૮૦ કિ.ગ્રા./હેક્ટર એક હપે આપવાથી (૨૩૦૭ કિ.ગ્રા./હેક્ટર) તેમજ બે હપે આપવાથી (૨૨૮૮ કિ.ગ્રા./હેક્ટર) ઉત્પાદન મળેલ. આ બધીજ માવજતો આંકડાકીય રીતે પરસ્પર

સમકક્ષ હતી. પરંતુ બાકીની માવજતો કરતાં આર્થિક રીતે ચંડિયાતી રહેલ. કપાસની સાઠિના ઉત્પાદનમાં આવાજ પરિણામો જોવા મળેલ હતા.

પોટાશ ખાતરની માવજતોથી કપાસના મુખ્ય ઉત્પાદન અને ગૈંગ (સાઠિ) ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે (કોઠા-૧). બી.ટી. કપાસમાં પ્રતિ હેક્ટરે ૧૫૦ કિલો ગ્રામ પોટાશ પાયાના ખાતર તરીકે અથવા બે હપ્તાએ (અર્ધો જથ્થો પાયાના ખાતર તરીકે અને અર્ધો જથ્થો ત૦ દિવસ બાદ) આપવાથી નિયંત્રણ માવજત કરતા ઉત્પાદનમાં ૧૩.૮ ટકાનો વધારો જોવા મળેલ. સાથે સાથે કપાસીયાનાં તેલનાં ટકામાં ૧.૩ ટકાનો વધારો જોવા મળેલ છે. કપાસની ગુણવત્તામાં પણ વધારો જોવા મળેલ છે. આમ, ત્રણ વર્ષના પરિણામોની સરેરાશ ઉપરથી માલુમ પડેલ છે કે બી.ટી. કપાસના પાકમાં હેક્ટરે ૧૫૦ કિલો ગ્રામ પોટાશ (પાયાના ખાતર તરીકે/ બે હપ્તે) આપવાથી બી. ટી. કપાસનું અર્થક્ષમ તેમજ સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મળેલ છે.

જસતની જુદી જુદી માવજતોથી બી. ટી. કપાસના ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે (કોઠા-૧). હેક્ટરે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ આપવાથી નિયંત્રણની માવજત કરતા કપાસના ઉત્પાદનમાં ૮.૪ ટકાનો વધારો જોવા મળેલ છે. જસત ૫૦ કિ.ગ્રા./હેક્ટરે આપવાથી બી. ટી. કપાસનું ઉત્પાદન (૨૩૦૮ કિ.ગ્રા./હેક્ટર) મળેલ. જે નિયંત્રણ માવજત કરતા ૨૦૦ કિ.ગ્રા./હેક્ટર વધારે હતું. વધુમાં જીક સલ્ફેટની અસર કપાસીયાના તેલના ટકામાં સાર્થક રીતે જોવા મળેલ ન હતી. પરંતુ જીક સલ્ફેટ આપવાથી કપાસીયાના તેલના ટકામાં વધારો થયેલ છે.

#### **પોટાશ અને જસત ખાતરની કપાસના ઉત્પાદનમાં પરસ્પર સંયુક્ત અસર :**

બી. ટી. કપાસના પાકમાં ૧૫૦ કિ.ગ્રા./હેક્ટર પોટાશ અને ૫૦ કિ.ગ્રા./હેક્ટરે જસત અલગ અલગ આપવાથી ઉત્પાદનમાં થતા વધારા વિષે અગાઉ ચર્ચા કરેલ. પરંતુ પોટાશ તત્વોની જુદી જુદી માવજતો સાથે જીક સલ્ફેટ આપવાથી બી. ટી. કપાસનું સૌથી વધુમાં વધુ ઉત્પાદન પોટાશ ૧૮૦ કિ.ગ્રા./હેક્ટરે પાયાના ખાતરની સાથે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ પ્રતિ હેક્ટરે આપવાથી (૨૪૮૬ કિ.ગ્રા./હેક્ટર) મળેલ (કોઠા-૨). ત્યાર બાદ અનુક્રમે પોટાશ ૧૫૦ કિ.ગ્રા./હેક્ટરે પાયાના ખાતર તરીકે સાથે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ પ્રતિ હેક્ટરે આપવાથી ઉત્પાદન (૨૪૬૬ કિ.ગ્રા.) મળેલ હતું. આમ આ પોટાશની બન્ને માવજતોના (૧૮૦ અને ૧૫૦ કિ.ગ્રા./હેક્ટર) કપાસના ઉત્પાદનમાં મામૂલી તફાવત જોવા મળેલ. આમ આ બન્ને સંયુક્ત માવજતો આંકડાકીય રીતે પરસ્પર સમકક્ષ હતી. જોકે બાકીની બધી જ માવજતો કરતાં સાર્થક રીતે ચંડિયાતી રહેલ. આમ બી. ટી. કપાસના પાકમાં પોટાશ અને જીક સલ્ફેટની સંયુક્ત માવજતથી કપાસના ઉત્પાદનમાં વધારો જોવા મળેલ (કોઠા-૨). કપાસના પાકમાં ફક્ત (એકલું) ૧૫૦ કિલો ગ્રામ પ્રતિ હેક્ટરે પોટાશ (બે હપ્તે અથવા પાયામાં) અને ફક્ત (એકલું) ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ આપવાથી કપાસના ઉત્પાદનમાં નિયંત્રણ માવજત કરતા અનુક્રમે ૧૩.૮ અને ૮.૪ ટકાનો વધારો જોવા મળેલ. પરંતુ પોટાશ ૧૫૦ કિ.ગ્રા./હેક્ટર ની સાથે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ આપવાથી બી. ટી. કપાસના ઉત્પાદનમાં નિયંત્રણ માવજત કરતાં ૨૨.૦ નો વધારો જોવા મળેલ. આમ કપાસના પાકમાં હેક્ટરે ૧૫૦ કિલો ગ્રામ પોટાશ ની સાથે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ આપવાથી બી. ટી. કપાસનું અર્થક્ષમ તેમજ સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મળેલ.

#### **અર્થકરણ**

બી. ટી. કપાસ ઉત્પાદનનાં અર્થકરણના આંકડા (કોઠા-૨) સ્પષ્ટ દર્શાવે છે કે કપાસ પાકમાં ૧૫૦ કિ.ગ્રા. પોટાશ પ્રતિ હેક્ટરે પાયામાં સાથે ૫૦ કિલો ગ્રામ જીક સલ્ફેટ પાયાના ખાતર તરીકે જમીનમાં આપવાથી રૂ. ૧૫૨૭૬ નો મહત્વમાં ચોખ્યો નફો મધ્યો હતો. વળી પ્રતિ એક રૂપિયાના ખર્ચ સામે ૬ રૂપિયાની ચોખ્યી આવક મળેલ.

#### **ભલામણ**

કૃષિ રસાયણશાસ્ત્ર વિભાગ અને કપાસ સંશોધન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના સહયોગથી દક્ષિણ ખેતી આબોહવાકીય વિસ્તારમાં મધ્યમ કાળી, ચુના યુક્ત જમીનમાં બી. ટી. કપાસ ઉગાડતા ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે કપાસના પાકમાં ભલામણ કરેલ નાઈટ્રોજન ખાતર ઉપરાંત ૧૫૦ કિલો ગ્રામ/હેક્ટરે પોટાશ, પાયાના ખાતર તરીકે અથવા બે હપ્તાની (અર્ધો જથ્થો પાયાના ખાતર તરીકે અને અર્ધો જથ્થો ત૦ દિવસ બાદ) સાથે ૫૦ કિલો ગ્રામ

હેકટરે ઝીક સલ્ફેટ જમીનમાં આપવાથી બી. ટી. કપાસનું અર્થક્ષમ ઉત્પાદન મેળવી શકાય છે. સાથે સૌથી વધુ ચોખું વળતર મળે છે.

### કોઠા-૧: પોટાશ અને ઝીક સલ્ફેટ ખાતરની બી.ટી.કપાસના ઉત્પાદન ઉપર સીધી અસર

ક્રમ	માવજત	ઉત્પાદન (કિ.ગ્રા./હેકટર)		તેલના (ટકા)
		કપાસ	સાઠિ	
<b>પોટાશ તત્વની માત્રા (કિલો ગ્રામ/હેકટર)</b>				
૧	નિયંત્રણ	૨૦૩૨	૨૭૬૫	૧૮.૨
૨	પોટાશ ૧૨૦ કિ.ગ્રા./હેકટર	૨૦૭૨	૨૮૦૫	૧૯.૯
૩	પોટાશ ૧૫૦ કિ.ગ્રા./હેકટર	૨૨૮૮	૩૨૦૮	૨૦.૫
૪	પોટાશ ૧૮૦ કિ.ગ્રા./હેકટર	૨૩૦૭	૩૧૯૩	૨૦.૬
૫	પોટાશ ૧૨૦ કિ.ગ્રા./હેકટર (બે હપ્તે)	૨૧૩૨	૨૮૬૩	૨૦.૦
૬	પોટાશ ૧૫૦ કિ.ગ્રા./હેકટર (બે હપ્તે)	૨૩૧૩	૩૧૯૯	૨૦.૨
૭	પોટાશ ૧૮૦ કિ.ગ્રા./હેકટર (બે હપ્તે)	૨૨૮૮	૩૧૭૮	૨૦.૮
	તાંત્રીક તફાવત (૫ ટકા)	૧૨૧	૧૮૨	૦.૫૮
<b>ઝીક સલ્ફેટની માત્રા (કિલો ગ્રામ/હેકટર)</b>				
૧	નિયંત્રણ	૨૧૦૮	૩૨૪૬	૨૦.૧
૨	ઝીક સલ્ફેટ ૫૦ કિ.ગ્રા./હેકટર	૨૩૦૭	૩૩૮૨	૨૦.૨
	તાંત્રીક તફાવત (૫ ટકા)	૬૪	૮૮	એન.એસ.

### કોઠા-૨ : પોટાશ અને ઝીક સલ્ફેટ ખાતરની બી.ટી.કપાસના ઉત્પાદન ઉપર પરસ્પર સંયુક્ત અસર

ક્રમ	માવજત (કિલો ગ્રામ /હેકટર)	ઉત્પાદન	અર્થકરણ (રૂ. / હેકટર)				ખર્ચ— આવક ચોખો ગણોતર
			કપાસ (કિ. ગ્રા. /હેકટર)	નિયંત્રણ કરતા વધારાની આવક	નિયંત્રણ કરતા વધારાનો ખર્ચ	નિયંત્રણ કરતા ચોખી આવક	
૧	નિયંત્રણ (પો.૦ સાથે જસત ૦)	૨૦૨૧	—	—	—	—	—
૨	પો.૦ સાથે જસત ૫૦ (કિ.ગ્રામ/હે.)	૨૦૪૩	૮૮૨	૧૭૫૦	(-૮૬૮)	—	—
૩	પો. ૧૨૦ (કિ.ગ્રામ/હે.) સાથે જસત ૦	૨૦૫૧	૧૨૦૨	૬૩૬	૫૬૬	૧:૦.૮૭	
૪	પો. ૧૨૦ સાથે જસત ૫૦ (કિ.ગ્રામ/હે.)	૨૦૮૩	૨૮૮૪	૨૩૮૬	૪૮૮	૧:૦.૨૧	
૫	પો. ૧૫૦ (કિ.ગ્રામ/હે.) સાથે જસત ૦	૨૧૩૧	૪૩૮૫	૭૮૫	૩૬૦૦	૧:૪.૫૩	
૬	પો. ૧૫૦ સાથે જસત ૫૦ (કિ.ગ્રામ/હે.)	૨૪૬૬	૧૭૭૮૮	૨૫૪૫	૧૫૨૫૩	૧:૬.૦૦	
૭	પો. ૧૮૦ (કિ.ગ્રામ/હે.) સાથે જસત ૦	૨૧૧૭	૩૮૫૫	૮૫૪	૨૬૦૧	૧:૩.૦૪	
૮	પો. ૧૮૦ સાથે જસત ૫૦ (કિ.ગ્રામ/હે.)	૨૪૮૬	૧૮૮૮૩	૨૭૧૪	૧૬૨૭૬	૧:૬.૦૦	
	તાંત્રીક તફાવત (૫ ટકા)	૩૬૦	—	—	—	—	—

પો. = પોટાશ, જસત = ઝીક સલ્ફેટ